

ન જગ્યાતિ લેખમાળા-મણુકો પાંચમો

# હવે કરવું શું ?

ફ

: લેખક :  
અનિલકુમાર

આ લેખમાં

૧ ચર્ચાનો પ્રશ્ન અતિ ભજીવનો છે.  
કંસણના જુદા જુદા માર્ગો.  
૨ જો કેટલાક વિચારણીય પ્રશ્નો.  
વર્ષની સંવત્સરીનું શું ?  
અના ફૂસ્ટીઓનું નિવેદન શું બતાવે છે ?  
૩ હક આત્માઓએ શું કરવું ?

વ ગે રે

૧ ઉપયોગી વિષયોની ચર્ચા કરવામાં આવી છે,  
ચિંતા વાંચો-વિચારો અને તેમાંથી સત્યનો કે  
પંદડે તેને દલતાથી વળગી રહેઠ, એ જ કલ્યાણનો

ગુરુદિપક :  
કાન્તિલાલ માણેકલાલ શાહ  
પાઠચાળ, અમદાવાદ.

પ્રથમ આવાજિ  
વિ. સં. ૨૦૧૩  
મુખ્ય  
પદ્ધતિ-પાઠક

મુદ્રક :  
શાહ નાનાલાલ સોમાલાલ  
સરોહય મુદ્રાખ્યાલય, સુ. સાદરા  
સ્ટે. ઉમાડા (એ. પી. રેલ્વે)

## હવે કરવું શું?

જૈન સમાજ જગ્યાય, પોતાની સ્થિતિનું સૂક્ષમ અવલોકન કરે અને તેમાં જે અંશો અપ્રશસ્ત કે અનિયચ્છાય જગ્યાય તેને હર કરવા કટિબદ્ધ થાય, એ હેતુથી શરૂ કરેલી આ વેખમાળામાં ‘જગ રે જૈન સમાજ’ , ‘આપણી હુદ્દશા’ , ‘તિથિ સંબંધી જાણવા જેવું’ અને ‘તિથિ અંગે તરખડાટ કેમ કેમ થયો?’ એ ચાર વેખો પ્રગટ થઈ ચુક્યા છે, તેમજ ‘હવે કરવું શું?’ એ નામનો આ પાંચમો વેખ પ્રગટ થાય છે, એટલે અમારી ચોજના પૂર્ણ થયાનો અંનંદ અનુભવીએ ધીયો.

તિથિયર્થનો પ્રક્રિ અતિમહત્વનો છે.

જૈન સમાજમાં સામાન્ય અભિપ્રાય એવો પ્રવર્તો છે કે હવે આ પ્રક્રિયાનું ચો઱્ય નિરાકરણ આવી જવું જોઈયો, પરંતુ કેટલાક તેનાથી વિરુદ્ધ જરૂર એમ પણ જગ્યાવે છે કે ‘પર્વતિથિ જેવા સાવ નળ્યાં, નમાલા અને અર્થાત્ય પ્રક્રિયાને કાગના વાધ કેવું લથંકરે રૂપ આપીને હજી

પ્રથુ આપણે આપણું પુષ્કળ શક્તિ, સમય અને સંપત્તિ એમાં બરખાદ કરીએ છીએ' તેથી એ મહાશયોને પૂછવાનું મન થાય છે કે 'પરતિથિનો પ્રશ્ન નજીવો, નમાલો કે અર્થાત્ય શા માટે ? શું તેની સાથે આપણું ત્રત, નિયમ, તપશ્ચયોહિ ધર્મોરાધનનાં અનેક અંગો સંકળાયેલાં નથી ? શું તેની સાથે આપણી સામુદ્દાયિક એકતાનો સંબંધ નથી ? શું તેના અંગો આપણે એક નિર્ણયાત્મક સ્થિતિ પર આવી જઈએ છીએ કે આજના તથકે જરૂરી નથી ? જે આ પ્રશ્નનો જવાબ હુકારમાં હોય, તો અમને કહેવા હો કે એના પ્રત્યે વૈશમાત્ર ઉપેક્ષા કરી શકાય નહિ, એટલું જ નહિ પણ તેનો સક્રણ ઉકેલ આણવા માટે શક્તિ, સમય અને સંપત્તિનો ગમે તેટલો બોગ આપવો બડે એ ઘણી ઝુશીથી આપવો જોઈએ.'

કેટલાક વખત પહેલાં એક મહાશયે લખ્યું હતું કે 'લીલોતરીનાં રક્ષણાર્થે આડમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આડમાદિ કહી નથી, માટે આડમાદિ તિથિનો હઠાથે મટાડવો. જે કાંઈ કહ્યું છે, તે હઠાથે કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતા પૂર્વક સદ્ગત સેવણાં.

'સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ

કરે છે. આથડુ કરનાર અને મિથ્યાત્વી છે; શાની પુલોચોં  
તિથિઓની ભર્યોદા આત્માર્થે કરી છે. જે ચોક્સ દિવસ નિયત  
ન કર્યો હોત તો આવશ્ય વિધિઓનો નિયમ રહેત નહિ. આત્માર્થે  
તિથની ભર્યોદાનો લાલ લેવો. બાકી તિથિબિધિનો.  
બેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહિ. એવી લંગન-  
ળમાં પડવું નહિં.

‘કદાથડુ મૂકવા અર્થે તિથિઓ કરી છે, અને બદલે  
તે જ દિવસે કદાથડુ વધારે છે. હાતમાં ધણું વર્ષો થયાં  
પર્યુષથાની તિથિઓની ભર્તાંતિ ચાલે છે. તિથિઓનો વાંધો  
કાહી તકરાર કરે છે. તે મોશે જવાનો રસ્તો નથી. કવચિત  
પાંચમનો દિવસ ન ચળાયો. અને છુટુ પાળો. અને આત્મામાં  
કોમળતા હોય તો તે ઝળવાનાંથાય, જેથી ખરેખરું પાપ  
લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે. પોતાથી અને  
તેવું છે તે રોકતો નથી ને થીજુ તિથિ આદિની લળતી  
ક્રિકર કર્યો જાય છે. અનાદિથી શર્ષદ, રૂપ, રસ, ગંધ ને  
સ્પર્શનો મોહ કર્યો છે, તે મોહ અટકાવવાનો છે. મોહું  
પાપ અસાનતું છે.’

આ શર્ષદો સામાન્ય લોકોને કદાથડુ છોડવાની હિત-  
શિક્ષા આપવા માટે ઢીક છે, પણ પરસ્પર વિસંવાદી અને  
શાસ્ત્રનો સ્પષ્ટ અનાદર કરનારા હોવાથી સુશ જનોને  
સ્વીકાર્ય થઈ શકે એવા નથી. કોઈ મીહાઈ સ્વાદમાં ધણી  
સુંદર હોય અને સુગંધથી મધમધતી હોય પણ વિષનાં

મિશ્રલુણવાળી હોય તો તેને આવાની ચૈછા કોણુ કરે ? આઠમાદિ તિથિ માત્ર લીલોતરીનાં રક્ષણ અર્થે કહી નથી, પણ પોષધાદિ અનુષ્ટાન, ખ્રષ્ણાચર્ચાનું પાલન, આરંભનો ત્યાગ અને વિશેષ પ્રકારનું તપ કરવાને કહેલી છે. તે માટે જ શાસ્ત્રકારોએ એવેસુ પોસહાઈ બંભ-અણારંભ-તવ વિસેસાઈ એ શફ્ફો ઉચ્ચારેલા છે. વળી એ લેખક મહાશયે ચ્યાથ અને પાંચમની માન્યતાવાળાને સામસામાં પહ્લવામાં એસાઠ્યા છે તે પણ ઉચ્ચિત નથી. સાચી હડીકરત એ છે કે શ્રી કાલિકાચાર્યે પ્રતિષ્ઠાનપુરમાં પાંચમને અદ્ભુત ચ્યાથની સંવત્સરી કર્તૃ ત્યારથી સકળ સંઘ ચ્યાથની સંવત્સરી કરતો આવ્યો હતો, પણ વિક્રમની ખારમી સહીમાં અંચલ વગેરે ગંધીજીવાળાઓએ પોતપોતાની માન્યતા સ્થાપિત કરવા માટે પાંચમનો આશ્રહ કર્યો અને એ રીતે સકળસંઘમાં ચ્યાથની સંવત્સરી થતી હતી, તેમાં લેદ પાડયો. પાછળથી મૂર્તિ-પૂજના વિરોધનાં કારણે સ્થાનકવાસી સંપ્રદાય નીકળ્યો, તેણે પરાપૂર્વથી ચાહ્યો આવતો ઔદ્યિક તિથિનો સિદ્ધાંત છાડી અસ્ત્ર તિથિનો સિદ્ધાંત સ્વીકાર્યો અને એ રીતે પાંચમની સંવત્સરી ચાહુ કરી, તેથી શ્રી સંઘમાં ચ્યાથ અને પાંચમના એ પક્ષો પડયા. આ બને પક્ષો પોતાની પ્રામાણ્યિક માન્યતા સુજખ તિથિનું પ્રતિપાદન કરે અને તે પ્રમાણે વર્તવાનો આશ્રહ રાખે તો તેને શું મિશ્રાત્મી સમજવા ? એ રીતે તો એમ પણ કહી શકાય કે, એક પક્ષ ઈશ્વરને માનવાનો આશ્રહ રાખે છે અને બીજે પક્ષ ઈશ્વરને નહિ માનવાનો આશ્રહ રાખે છે, માટે બને

મિથ્યાત્વી છે.’ અથવા ‘એક પક્ષ અહિંસાને માનવાનો આશ્રહ રાખે છે અને બીજો પક્ષ હિંસાને માનવાનો આશ્રહ રાખે છે, માટે બંને મિથ્યાત્વી છે.’ અહીં જે એમ કહેવાનો આશય હોય કે ‘ચોથ અથવા પાંચમનો આશ્રહ નહિ રાખનારા શુદ્ધ સમકિતી છે.’ તો પણ યથાર્થ નથી. કેમ કે બેમને ધર્મનું કોઈ પણ પ્રકારનું આરાધન કરવું નથી તેમને ચોથ કે પાંચમનો જરાએ આશ્રહ હોતો નથી.

એ મહાશય લખે છે કે, ‘જાની પુરુષોએ તિથિની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કરી હોત તો આવશ્યક વિધિઓનો નિયમ સચ્ચવાતું નહિ.’ એટલે સૂચિત થાય છે કે પર્વતિથિની ચોજના ખૂબ સમજશુપૂર્વક થચેલી છે અને તેનાં આરાધન માટે એક દિવસ સુકરર હોવો જેઠાં એ વાત બેમને પણ માન્ય છે, પરંતુ ત્યાર પછી તેચો તરત જ જણાવે છે કે ‘આત્માર્થે તિથિની મર્યાદાનો લાલ હોવો. આકી તિથિબિથિનો લેદ મૂકી હોવો. એવી લાગણગમાં પડવું નહિ.’ ત્યારે આપણું મનમાં પ્રશ્ન ઉઠે છે કે ‘આ તે કઈ જલનું પ્રતિપાદન ?’ જે પર્વતિથિની મર્યાદા જાની પુરુષોએ ખૂબ સમજશુપૂર્વક આત્માર્થે કરેલી છે અને તે માટે કોઈ એક ચોક્કસ દિવસ સુકરર હોવો જેઠાં તો ‘તિથિ-બિથિનો લેદ શા માટે મૂકી હોવો ? એવી સલાહ શા માટે અપાય છે ? એ રીતે તો ધર્મારાધન માટે અધા દિવસો સરખા ગણુતાં પર્વતિથિનું કઈ પણ માહાત્મ્ય રહેશે નહિ અને શાબ્કારોએ ‘તે દિવસે વિશેષ પ્રકારે

ધર્મનું આરાધન કરવું જોઈએ, એવી ને આજા દૂરમાવી છે, તેનું સ્પષ્ટ ઉત્ત્વંધન થશે. વળી તેઓ તિથિના લેફને લંગજણ તરીકે ઓળખાવે છે, લારે પૂછવાનું મન થાય છે કે શું એ કોઈને છેતરવા માટેની ભૂલભૂલામણી છે કે ધર્મનું આરાધન કરવાની એક પ્રકારની ગોડવણું છે?

આગળ તેઓ પાંચમને દિવસ ન પળાયો તો છુફુનો દિવસ પાળવાનું જે વિધાન કરે છે, તે પણ એટલું જ ભ્રામક છે. એ રીતે જિનાજાનો લંગ થાય છે; પર્વતિથિનું આરાધન કરવામાં શુલાયુષ્યનો અંધ વગેરે ને હેતુએ કહેલા છે, તે સચ્ચવાતા નથી અને એક મનુષ્ય પાંચમને બદલે છુફુ સંવત્સરી કરે અથવા અનુઝળતા સુજઘ સાતમ, આડમ કે નોમે સંવત્સરી કરે તો સકળ સંધમાં લંગાણું પડે અને એકવાક્યતા તૂટી જય એ નિશ્ચિત છે. આ સંઘોગોમાં ઉપર્યુક્ત વચ્ચેનોને કોઈપણ પ્રકારનું મહત્વ રહી રીતે આપી શકાય? તાત્પર્ય કે તિથિચર્ચાનાં નિરાકરણને અલ્યંત મહત્વનું માની તે માટે શક્ય પ્રયત્નો કરવા જ જોઈએ.

### નિરાકરણ માટેના જુદા જુદા માર્ગો.

કેટલાક કહે છે કે તે માટે વિ. સં. ૧૬૬૦ માં અમદાવાદ ખાતે જેવું સાધુ સંમેલન ચોળયું હતું, તેવું જ ખીજું સાધુસંમેલન ચોળવું જોઈએ અને તેના દ્વારા આ પ્રક્ષણનું ચોઝ્ય નિરાકરણ લાવવું જોઈએ,

પરંતુ તે વાખતની પરિસ્થિતિમાં અને આજની પરિસ્થિતિમાં મોટું અંતર છે. આને બધા સાધુઓ લેગા થાય તો તે બધા પર કોઈ એકનો કાણું રહે તેવી સ્થિતિ નથી. વળી શાસ્ત્રને અડગ વળગી રહી યોલવા—ચાલવાનું ઓછું હેખાય છે અને એવું જૂથ પ્રમાણમાં છે, એટલે તે રીતે શાસ્ત્રાધારે નિર્ણય થાય એવો સંબન્ધ અહું એછો છે. વળી આવું સંમેલન કોણું યોલાવે? તેને પાર પાડવાની જવાબદારી કોણું ઉઠાવે? એ પ્રશ્નો પણ અત્યંત વિચારણીય છે, એટલે બીજું સાધુ સંમેલન યોલાવી આ પ્રક્રિયાનું ચોઝ્ય નિરાકરણ આણવાની સૂચના અમને વ્યવહારું જણ્ણાતી નથી. એના કરતાં આગેવાન આચાર્યોને એકત્ર કરવાની અને તેમના દ્વારા આ પ્રક્રિયાનું ચોઝ્ય નિરાકરણ લાવી હેવાની ચોજના અમને વિશેષ વ્યવહારું જણ્ણાય છે.

### તે અંગે કેટલાંક વિચારણીય પ્રશ્નો

પ્રશ્ન : આગેવાન આચાર્યોને કોણ લેગા કરે?

ઉત્તર : અમદાવાદનો શ્રીસંધ કે અમદાવાદના આગેવાનો ધારે તો બધા આગેવાન આચાર્યોને લેગા કરી શકે.

પ્રશ્ન : આગેવાન આચાર્યો ડેને ગણુવા?

ઉત્તર : એ પ્રક્રિયાનું નિરાકરણ અમદાવાદના શ્રીસંધને કે અમદાવાદના આગેવાનોને જ કરવા હો. આ ભાષ્ટતમાં અન્ય કોઈ પણ સંધ કે સંસ્થા કરતાં તે બધારે સારો ઘ્યાલ ધર્યાવે છે.

પ્રશ્ન : આ પ્રકારનાં આચાર્યોનાં સંમેતનમાં બધા આચાર્યો લાગ લેશે, એમ તમે માનો છો ?

ઉત્તર : જે કુનેહથી કામ લેવામાં આવે તો બધા આગેવાન આચાર્યોનેમાં લાગ લેશે, એમ અમારું માનવું છે.

પ્રશ્ન : માનો કે એ વખતે કોઈ આચાર્ય સાછું ના પાડી તો ?

ઉત્તર : એવું બનવાનો સંભવ નથી. અમદાવાદમાં દરેક આચાર્યના ખાસ લક્ત શ્રાવકો છે, તે આ બાધતમાં ઘણું સહાયભૂત થઈ શકે એમ છે.

પ્રશ્ન : આગેવાન આચાર્યો વહેલામાં વહેલા કયારે મળી શકે ?

ઉત્તર : હાલ તો ચાતુર્માસ ચાલુ છે, એટલે કોઈ આચાર્ય વિહાર કરી શકે નહિ, પણ આસો માસ સુધીમાં આવું સંમેતન યોદાવવાનો નિર્ણય લેવાઈન્ય અને વિધિ-સરનાં આમંત્રણો અપાઈ જાય તો કાર્તિકી ચૌદશ પછી તે બધા આચાર્યો અનુકૂળતા મુજબ અમદાવાદ કે આવું સંમેતન ભરવાતું હોય તેં લાણી વિહાર કરે અને એ રીતે ક્રાગણુ ચામાસી પહેલાં બધા આગેવાન આચાર્યો મળી શકે.

પ્રશ્ન : માનો કે અમદાવાદના શ્રી સંદે આગેવાન

આચાર્યોને એકત્ર કર્યો, તો આ સંબંધી કામકાજ કેવી પદ્ધતિએ ચાલશે ?

**ઉત્તર :** આ સંમેલનમાં એકત્ર થરેલા પૂર્ણ આચાર્ય લગ્નવંતો શાસ્ત્રપાઠ તર્થી સુવિહિત પરંપરાને સામે રાખીને આ વિષયની ચર્ચા કરશે. તેમાં જરૂર પડતાં પાંચ દંશાં આગેવાન શ્રાવકોને સાથે રાખશે તર્થા વિશેષ જરૂર જાણુંતાં સંસ્કૃત લાખાના ઉત્તમ વિદ્ધાનોને સાથે રાખી તેમનો પ્રામાણિક અભિપ્રાય લેવાશે, જેથી સકળ સંઘ ચોજ્ય આ ચર્ચાનું છેવટનું નિરાકરણ બહાર પાડવાનું સરળ અનશે.

**પ્રશ્ન :** તમે આગેવાન આચાર્યોને એકત્ર કરવાની ચોજના અતાવી તે ઢીક છે, પણ માનો કે લવિતાંત્રાના ચોજે તેમાંનું કંઈ બની શક્યું નહિં, તો આ પ્રશ્નનો ઉકેલ આખુવાનો અન્ય કંઈ ઉપાય બરો ?

**ઉત્તર :** જે એવું કંઈ ન અને તો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અમને એક ઉપાય સ્ફૂર્તે છે. તે એ કે દરેક આચાર્ય મહારાજે પોતપોતાની માન્યતાને યુક્તિ અને શાસ્ત્રાધાર સાથે લેખ લખી શ્રી આખુંદળ કલ્યાણુલુની પેઢીને સોંપી હેવો. શ્રી આખુંદળ કલ્યાણુલુની પેઢી એ દરેક લેખની નકલો તૈયાર કરાવી બધા આચાર્યોને મોકલે અને તેઓને એ સંબંધમાં જે જવાબ આપવો હોય તેનો સ્વીકાર કરો. પછી એ બધા લેખો પોતાને ઉચ્ચ કક્ષાના લાગે તેવા ૨-૪ સમર્થ વિદ્ધાનોને વંચાવી, એક નિર્ણય એવો મેળવે

કું ‘જૈન શાસ્ત્રાધારે આચારીએ આપેલા લખાળો જેતાં લાગે છે કે શાસ્ત્ર-સંભત માર્ગ આ છે...’ એ નિર્ણય પેઢી શ્રમણ સંધને જણાવે અને શ્રમણ સંધ તે પ્રમાણે વર્તવાની સકળ-સંધને આજા કરવાવે. અમને લાગે છે કે આ રીતે પણ આ જટિલ પ્રક્રિયા જીકેવ આણી શકાય.

### આ વર્ષેની સંવત્સરીનું શું?

પ્રક્રિયા:- આગેવાન આચારીને એકત્ર કરે કે શ્રી-આણુંદળ કલ્યાણલની પેઢી મારકૃત દરેકની માન્યતાને બ્રહ્મ મંગાવી નિર્ણય કરે. તો પણ તેમાં આઠથી દશ માસ જેટલો સુભય જવા સંભવ છે, દરમિયાન સંવત્સરીનો પ્રક્રિયાના થયો છે, તેનું શું?

ઉત્તરઃ- આ વર્ષે સર્વ તપાગચ્છને માન્ય એવા ચંડાણું પંચાંગમાં ભાદરવા સુદિ ૫ નો ક્ષય છે અને ભાદરવા સુદિ ૪ ને અખંડ ઔદ્ઘિક તિથિ બતાવેલી છે, એટલે સકળ-સંધે સંવત્સરી ભાદરવા સુદિ ૪ શુરૂવારે કરવી જોઈએ. સ. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૮ અને ૨૦૦૪ની સાલમાં ચંડાણું પંચાંગમાં ભાદરવા સુદિ ૫ નો ક્ષય આવ્યો, ત્યારે અમુક અપવાહ સિવાય સકળસંધે ચંડાણુંએ બતાવેલી ઔદ્ઘિક ચાથની આરાધના કરી હતી, એટલે આ વર્ષે એ પ્રણાલિકામાં ફેરફાર કરવાનું કોઈ કારણ નથી, પરંતુ પ્રગટ થયેલી પત્રિકાઓ અને પ્રસિદ્ધ થયેલાં નિવેદન પરથી લાગે છે કે

આ વર્ષે પૂજ્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજીનો સમુદ્દરાય, પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનો સમુદ્દરાય, પૂજ્યશ્રી વિજયવલભ સૂરીશ્વરજીનો સમુદ્દરાય, પૂજ્યશ્રી વિજયનીતિ સૂરીશ્વરજીનો સમુદ્દરાય વગેરે ખુધવારની સંવત્સરી કરશે અને પૂજ્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીનો સમુદ્દરાય, પૂજ્યશ્રી વિજયલઘિસૂરીશ્વરજીનો સમુદ્દરાય, પૂજ્યશ્રી વિજયગ્રેમસૂરીશ્વરજીનો સમુદ્દરાય વગેરે ગુરુવારની સંવત્સરી કરશે.

**પ્રશ્નઃ:-** પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદ્દરાચે તો ગુરુવારે સંવત્સરી કરવાનું જાહેર કર્યું હતું અને તમે કહો છો કે તેઓ ખુધવારની સંવત્સરી કરશે, તો તેમાં સાચું શું સમજવું ?

**ઉત્તરઃ:-** પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદ્દરાચે પોતાના પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે ગુરુવારની સંવત્સરી સાચી માની તેનું આરાધન કરવાની જહેરાત કરી હતી, પણ સુંખઈના શ્રી ગોડીજી દહેરાસરના દ્રસ્ટીઓ તથા શ્રી દેવસુરસંબન્ધના કેટલાક આગેવાનો તેમને ખુધવાર કરાવવા મળ્યા પછી તેમણે ખુધવાર માટે સંમતિ આપેલી છે અને તે આબતતનું એક નિવેદન શ્રી ગોડીજીના દ્રસ્ટીઓએ પોતાની સહીથી બહાર પાડેલું છે, તે નીચે સુખભ :-

ગોડીજીના દ્રસ્ટીઓનું નિવેદન શું બતાવે છે ?

ચાલુ વર્ષમાં સંવત્સરી પર્વની આરાધના લાદરવા સુદ ૪ ને ખુધવારની થશે.

શ્રી વિજયદેવસુર (ગોડીજી) સંચે સંવત્સરી પર્વની

આરાધના બાબત એકચ્ચતા થાય તે માટે નીચે મુજબ  
પ્રયાસ કર્યો હતો:-

અમો શ્રીગોડીલુના દ્વસ્તીઓ તથા શ્રીદેવસુરસંઘના  
આગેવાનો વગેરે રાજનગર સુકામે પરમ પૂજ્ય આચાર્યથી  
વિજયાદ્યસ્તુરીશ્વરાલુ મહારાજશ્રી પાસે પરંપરાગત તિથિ  
માન્યતાની એકતા અંગે આગામી સંવત્સરીના દિવસનો  
નિર્ણય એકમતે કરવાની વિનંતિ અર્થે તા ૧૦-૩-૫૭ના  
રોજ ગયા હતા અને વિનંતિ કરી હતી. તેઓશ્રીએ પોતાના  
પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે ગુરુવાર વ્યાજથી છે,  
તેમ એ કલાક સુધી વિવેચન કરી અમોને સમજાયું  
હતું. વધુમાં તમામ તપાગચ્છ માટે એક જ દિવસે સંવત્સરીની  
તથા તિથિની આરાધના થાય તેવા પ્રયાસો કરવા તેઓશ્રીએ  
અમોને જણાયું હતું, જે પ્રયાસો કરવાનું અમોને પણ  
વ્યાજથી લાગતું હતું.

દરમ્યાન આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે  
થાય તે હાલ શક્ય નહિ લાગવાથી કરીથી તા ૭-૪-૫૭.  
ના રોજ તેઓશ્રી પાસે કોઠ સુકામે અમે વિનંતિ કરવા  
ગયા અને પ્રાચીન પરંપરાવાળા સમક્ત શ્રી દેવસુરસંઘની  
એક આરાધના થાય અને એકચ્ચતા સચવાય તે માટે આ  
વખે ચોથ બુધવારની સંવત્સરી કરવા માટે ખૂલ આશહેલરી  
વિનંતિ કરી અને તેઓશ્રીએ ઉદાર દીલ રાખી એકતા  
ખાતર અમારી વિનંતિને માન આપી ચોથ બુધવારની

સંવત્સરી આરાધવામાં સંમતિ આપી છે અને અમારી વિનંતિને નીચે મુજબ જવાબ આપ્યો છે:-

‘ અમારા પૂજય, વડીલોની આચરણું પ્રમાણે અન્ય પંચાંગના આધારે છક્કોનો ક્ષય માનીને ચોથને ગુરુવારની સંવત્સરીની અમારી બ્યાળથી માન્યતા હોવા છતાં આ વર્ષે અમારી એટલે શ્રીગોડીલુના દ્રસ્તીઓની તથા શ્રીહેવ-સુરસંધના અન્ય આગેવાન ગૃહસ્થોની આગ્રહલરી વિનંતિથી પ્રાચીન પરંપરાવાળા સમસ્ત શ્રી હેવસુર સંધની એક આરાધના થાય અને એકતા સચ્ચવાય તે માટે આ વર્ષે ચોથ ને ખુખુવારની સંવત્સરી આરાધવામાં અમે સંમતિ આપીએ છીએ.’

આ પ્રમાણે જવાબ આપી તેઓશ્રીએ સમાજ ઉપર અનુગ્રહ કર્યો છે, તે બદલ શ્રી વિજયહેવસુર સંધ તેઓશ્રીને ઝણું છે અને તેઓશ્રીને કોઈશ : ધન્યવાદ આપે છે.

પાનાચંદ રૂપચંદ જીવેની  
લક્ષ્મીચંદ હુલ્લિભલ્લ શાહ  
મનેલુંગ દ્રસ્તીએ.

આ નિવેદન મુંખી સમાચારના તા. ૧૫-૪-૫૭ ના અંકમાં તથા જૈન પત્રના તા. ૨૦-૪-૫૭ ના અંકમાં છપાયેલું

છે, તેના આધારે અમો કહીએ છીએ કે તેઓ આ વખતોં  
ઝુઘવારની સંવત્સરી કરશે.

અહીં પ્રાસંગિક એટલું સ્પષ્ટીકરણ કરી દઈએ કે  
ગોડીળુના દ્રસ્તીઓ વગેરે પરમ પૂજય આચાર્ય શ્રી વિજયોદ્ધ  
સૂરીકૃતરળને ગીતાર્થ, અહુશુત અને વચ્ચેાવુદ્ધ માનીને તેમની  
પાસે તિથિ માન્યતાની એકતા અગે વિનંતિ કરવા ગયા  
હતી, ત્યારે તેઓશ્રીએ તેમને એ વસ્તુએ કહી હતી : એક  
તો પૂજય વડીલોની પરંપરા પ્રમાણે સંવત્સરી શુરૂવારે  
કરવી વ્યાજથી છે, માટે સંવત્સરી શુરૂવારે કરવી અને  
થીળિંગની તમામ તપાગચ્છ સંવત્સરીની તથા અન્ય તિથિઓની  
આરાધના એક જ દિવસે કરે તે માટે પ્રયાસો કરવા.  
પૂજયશ્રીની આ સલાહ સત્યની વ્યાખ્યા કરનારી હતી  
તથા તેમનાં દ્વિલમાં એકતાની જે વાત રમી રહી હતી,  
તેથી સ્પષ્ટત્યા પ્રતિભિંબ પાડનારી હતી, પરંતુ શ્રીગો-  
ડીળુના દ્રસ્તીએ વગેરેને એ સલાહ ગમી નહિ, એટલે  
તેમણે શુરૂવારે સંવત્સરી કરવાની જહેરાત કરી નહિ, તેમજ  
આગેવાન આચાર્યોને મળીને એકતા માટેના પ્રયાસો પણ  
કર્યા નહિ. એટલું જ નહિ પણ તેમણે પૂજયશ્રીની વ્યાજથી  
માન્યતા ફેરવવાનાં ચેકો ગતિમાન કર્યાં અને તા. ૭-૪-૫૭  
ના રેઝ કોઠ મુકામે કરી વિનંતિ કરવા ગયા. તે વખતે  
અરેખરી વાતો શી થઈ હશે, તે આપણે જાણી શકવાની  
સ્થિતિમાં નથી પણ તેમણે જે નિવેદન બહાર પાડ્યું છે,  
તેના પરથી સમજય છે કે તેમણે વિનંતિનાં રૂપમાં

પૂજયકી પર લારે દથાણુ કંચું હશે અને ચેનકેનુ  
પ્રકારેણ બુધવાર પક્ષમાં એસાહવાનો આગ્રહ સેવ્યો હશે.

**પ્રશ્ન :** ગોડીળના દ્રદ્દીઓએ આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શક્ય લાગતું નથી એવું નિવેદન શા આધારે કંચું હશે ? જે પહેલેથી જ આ વાત તેમના મનમાં ઠસેલી હતી, તો એકતાની વાત શા માટે ઉચ્ચારી હશે ?

**ઉત્તર :** અમને લાગે છે કે આજે આખા સમાજની હવા એક જ દિવસે પર્વતિશિતું આરાધન થાય એ રીતે તિથિયાનો અંત લાવવાની છે, એટલે તેમણે એકતાની વાત ઉચ્ચારી હશે, પણ તેવી પરિસ્થિતિ પેઢા કરવા માટે જે સમય અને શક્તિને લોગ આપવો જોઈએ, તેનો વિચાર કરતાં તેમના દિવિને થડકાટ થયો હશે અને આજ સુધીમાં જેમણે એ દિશામાં અધુરા અને અવ્યવસ્થિત પ્રયાસો કર્યો, તેનાં પરિણામો તેમની નજર આગળ તરવ્યાં હશે, એટલે તેમણે ‘આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શક્ય લાગતું નથી’ એવો નિર્ણય કર્યો હશે. પરંતુ અહીં તેમણે એવો વિચાર કરવાની જરૂર હતી કે શ્રીસંઘમાં એકચ સ્થાપણું હોય તો સમય અને શક્તિને લોગ અવશ્ય આપવો પડે અને જે રીતે કાર્ય-સિદ્ધિ થવાની શક્યતા હોય તે રીતિ અપનાવવી પડે. બણી પૂર્વના પ્રયાસો નિષ્ફળ ગયા, માટે આ પ્રયાસ નિષ્ફળ

જશે એમ માની લેવાની કોઈ આવશ્યકતા ન હતી. સંભવ છે કે પૂર્વના પ્રયાસો ચોણ્ય રીતે થયેલા ન હોય કે તે માટેનો સમય પાકચો ન હોય, તેમજ એ જાણી લેવું પણ જરૂરી હતું કે આવા પ્રક્રિયા પ્રારંભમાં ઘણ્યા અધરા લાગે છે, પણ અનન્ય આત્મક્રિયાપૂર્વક પુરુષાર્થ કરવામાં આવે તો અહું સરળતાથી ઉકલી જાય છે.

**પ્રક્રિયા :** આ પગલું ભરવાથી નિવેદનકારો જણ્યાવે છે તેમ સમસ્ત શ્રીહેવસુરસંધની એક આરાધના થઈ શકશે ખરી ?

**ઉત્તર :** એક વર્ગને જાણી ખૂઝીને અત્યાર રાખવો અને એકતાની વાત કરવી એતો હસવા ને લોટ ફ્રાંકવા જેવી બેહુદી વાત છે. અમે માનીએ છીએ કે આ રીતે વર્ત્તવાથી તો હેવસુર સંધમાં કાયમની કૂટ પડી જશે અને તેમાંથી નવા નવા ફણુગાએ કૂટતાં સમસ્ત સંધનું બળ છિન્ન લિન્ન થઈ જશે. વળી ખરી વાત તો એ છે કે ગોડીલુનો સંધ એ કંઈ સમસ્ત હેવસુર સંધ નથી ! અરે ! હેવસુર સંધ કે જે ભારતના અનેક થ્રામ-નગરોમાં વસેલો છે, તેની સંખ્યાના પ્રમાણમાં ગોડીલુસંધ મહત્વની સંખ્યા પણ નથી ધરાવતો ! અને ખુદ મુંબથિના અનેક ઉપાશ્રયના સંધની અપેક્ષાએ એ એક અંશ માત્ર છે. એટલું જ નહિ, ખુદ ગોડીલુસંધમાં પણ એ લેદ છે, તે મુંબથઈ સમાચારમાં ગોડીલુસંધવાળામાંથી ૪૨ સહીઓથી બહાર પડેલા વિરોધ

પત્રથી જહેર થઈ ચૂક્યું છે. આગળ વખ્તીને જોઈએ તો શ્રી જૈન શાસનમાં સંઘ શખદથી માત્ર શ્રાવકો નથી લેવાતા, પરંતુ પૂ. સાધુઓ, પૂ. સાધ્યીજીઓ, શ્રાવકો અને શાબ્કાઓને સમુદ્દરાય લેવાય છે. હવે વિચારો કે કહેવાતા દેવસૂરસંઘમાં કોને ગણ્યા ?

**પ્રશ્ન :** એક ગીતાર્થ, ખડુશ્રુત, પ્રૌઢ આચાર્ય પોતાની માન્યતા એક પ્રકારની જહેર કરે અને વર્તવાનો આદેશ ધીજા પ્રકારે આપે, તે કેટલું ઉચિત છે ?

**ઉત્તર :** એનો ખરો જવાબ તો એ મહાપુરુષ જાઝાપી શકે, પણ અમારી દસ્તિએ એમનું દીલ એથી સંતાપ અનુભવતું હશે; કેમકે શાસ્કડારોએ રૂપણ ઉલ્લું છે. કે 'જે સત્ય છે તે જ આચરવા ચોણ્ય છે અને જે આચરવા ચોણ્ય છે તે જ સત્ય છે.' એટલે સત્ય અને તેની આચરણ વચ્ચે લેદ કરી શકાય નહિ. અથવા આની પાછળ દીર્ઘ દસ્તિનો એ આશય હોય શકે કે ખુખવારવાળાને આ વખતે સાથે રાખો, એથી હવે પછી આ લોકોને શાસ્કીય એક નિર્ણય લાવવામાં અનુકૂળ વતોવી શકાય.

**આરાધક આત્માઓએ શું કરવું ?**

**પ્રશ્નઃ—આ સંભેગોમાં આરાધક આત્માઓએ શું કરવું ?**

ઉત્તર : આરાધક આત્માઓએ તો જિનાશામાં સ્થિર રહેવાનું છે અને જે વસ્તુ શાશ્વત તથા પરંપરાથી સિદ્ધ છે, તેને જ અનુસરવાનું છે. જ્યારે મૂળ્યશી વિજ્ઞાનોદ્યસૂરિલુણે જાહેર જ કર્યું છે કે પોતાના મૂળ્ય વડીલોની પરંપરા પ્રમાણે શુલ્કાર વ્યાજભી છે, લારે સંવત્સરી શુદ્ધવારે કરવામાં આરાધક આત્માઓને જરા પણ સંકોચ હોઈ શકે નહિ. અહીં અમે સર્વે આરાધક આત્માઓને એક વસ્તુ રહેવા ઈચ્છાઓ છીએ કે તિથિ સંબંધિ આચારોમાં મતસેદ જોઈને કે સંઘની ડામાડોળ સ્થિતિ નિહાળીને ધર્મારાધનની ધાર્થતમાં કોઈએ શિથિત થવું નહિ. કાલાંતરે એ બધું રીક થઈ જશે અને શ્રી જિનેશ્વર લગવાનનું શાસન જયવંતુ રહેયે, એવી દદ શ્રદ્ધા હૃદયમાં, ધારણુ કરી પોતાના આત્માનું હિત સાધવામાં નિરંતર ઉજવણ રહેવું તથા કુમતિ -કદાચહનો ત્યાગ કરી અની શકે તેટલું લવાંતરનું ભાથું આંધી લેવું.

## ઉપસંહાર

તિથિના વિષયમાં ઉપલબ્ધ થતાં કેટલાંક શાશ્વતપ્રમાણો પરિશિષ્ટમાં આપ્યાં છે, તે દરેક પાઠકે વાંચવા-વિચારવા અને તેમાં કોઈ આખતની સમજણ ન પડે તો શુરૂજનો પાસેથી તેનો ઝુલાસો મેળવી લેવો.

સહુનું કલ્યાણ થાયો, સહુ અજરામર સુખની પ્રાપ્તિ  
 કરો એ અલિકાષા સાથે આ જૈન જગૃતિ નામની દેખ-  
 માળા પૂરી કરીએ છીએ અને તેમાં કોઈનું પણ મન  
 હુભાવવાનો પ્રસંગ ક્રાવ્યો હોય તો તેની ત્રિવિધ ક્ષમા  
 યાચીએ છીએ.

જૈન જગૃતિ શાસનમ् ॥



## પરિશાષ્ટ

તિથિ સંબંધમાં શાસ્ત્રપ્રમાણે।

### [૧] ઉત્કર્ષ નિયમ

ઉદ્યંભ જા તિહિ સા પમાળમિઅરીઇ કીરતમાળીએ।  
આણામગડણવત્થા મિચ્છત્તવિરાહણ પાવે ॥

—આઙ્ગિધિ-

આરાધના માટે, સૂર્યોદય વખતે ને તિથિ હોય તે  
પ્રમાણુ ગણ્યાય છે. ( તે આજો હિવસ તે તિથિ આરાધ્ય  
કરાય છે. ) એને છાડિને બીજુ કરવામાં આજાલંગ, અન-  
વસ્થા, મિથ્યાત્ત્વ અને વિરાધના હોય લાગે છે.

### [૨] અપવાહ નિયમ

ક્ષયે પૂર્વા તિથિ : કાર્યા, વૃદ્ધી કાર્યા તથોત્તરા।

— શ્રી ઉમાસ્વાતિપ્રધોષ..

તિથિનો ક્ષય હોય ( અર્થાત્ સૂર્યોદયમાં ન હોય ) તો  
પૂર્વની તિથિ આરાધ્ય કરવી અને વૃદ્ધિ હોય ( એ સૂર્યો-  
દયને સ્પર્શાતી હોય ) તો બીજુ તિથિ કરવી.

### [ ૩ ]

જો તિથિનો ક્ષય હોય તો પૂર્વતિથિમેં કરણી, જો  
વૃદ્ધિ હોવે તો ઉત્તરતિથિ લેણી. ( આમા પૂર્વતિથિનો ક્ષય  
કરવાનું નથી કહું. )

—શ્રી સાગરાનંદસુરીશ્વરજીના ગુરુ શ્રી ઊરેરસાગરજી મહારાજ..

[ ४ ]

‘क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणं’ सातम्भां  
करातुं क्षीष्याष्टमीतुं कृत्य. ‘क्रियतां नाम तर्हि चतुर्दशीकृत्यं  
नयोदद्यामपि’ ‘ते। पधी क्षीष्य चैदशतुं कृत्य पष्ठ तेर-  
शमां ७४ करो।’ (अहीं पष्ठ ७ के १३ नो क्षय नशी करो।)

—तत्त्वतरंगिणी, पृष्ठ ४.

[ ५ ]

‘तिथिनो क्षय होवे तो पहिली तिथिमें और वृद्धि  
होवे तो उत्तरकी तिथि विषे धर्मकृत्य करणा।’

—जैन सिद्धांत सामाचारीना प्रवर्त्तक श्री कातिविजयज्ञ.

[ ६ ]

तिहिवाप पुब्वतिही अहिवाप उत्तरा य गहिवव्या ।  
(तत्त्वतरंगिणी, पृ. ३)

**भावार्थ** : ‘तिथि क्षय होय त्यारे पूर्वतिथि ७  
अष्टष्ठु करवी, वृद्धि होय त्यारे थीलू ७ तिथि अष्टष्ठु करवी।’

‘७’ कार तो अस्तरगच्छवाणाच्चो चौदशना क्षये  
पुनमे पर्खी करे छे तेनो अने वृद्धिमां नेच्चो पहेली तिथि  
आने छे तेमनो निषेध करवा माटे वापच्चो छे.

“ જ ” કારથી તેમ જ ‘ કશે પૂવો ’ વાક્યથી તિથિને એ ‘ ક્ષય કરવો ’ અને ‘ વૃદ્ધિ કરવી ’ એવો અર્થ જેએ ઉપભોગે છે, તેમના મતે તો પુનમનો ક્ષય હોય ત્યારે પૂર્વની ચૌદ્ધને જ ક્ષય મનાશે, પરંતુ પૂર્વતર એટલે કે તેનાથી ચે પહેલાંની તેરસ તિથિને ક્ષય માની શકાશે નહિ અને વૃદ્ધિ હોય ત્યારે પછીની એટલે પુનમની વૃદ્ધિએ એકમ તિથિની જ વૃદ્ધિ માનવી પડશે.

[ ૭ ]

‘ કિન્તુ ગ્રાયશ્ક્રિતાદિવિધી ચતુર્દશ્યેવેતિ વ્યપદિશ્ય-  
માનત્વાત् ॥ ( ત૦ ત૦ ષ. ૩ )

**ભાવાર્થ :** ‘ પણ ગ્રાયશ્ક્રિતાદિ વિધિમાં ચૌદ્ધ  
જ કહેવાય છે માટે.’ આથી સ્પષ્ટ જણાય છે કે—‘ ગ્રાય-  
શ્ક્રિતાદિ વિધિમાં ચૌદ્ધ કહેવાનું ’ શ્રી ધર્મસાગરજીએ  
કરમાણું છે, લૌકિક વિધિમાં તો ઉદ્યતિથિ તેરસ હોવાથી  
તેને તેરસ જ કહેવાય.

[ ૮ ]

‘ અહ જા કહવિ ન લભંતિ તાઓ સુરુગમેણ જુતાઓ ।  
તા અવરવિદ્ધ અવરા વિ હુજ્જ, ન હુ પુકુ તબ્બિદ્ધા ॥ ’  
( ત૦ ત૦ ષ. ૩ ).

**ભાવાર્થ :** હુદે કે કદાપિ સૂરોહ્યથી ચુક્તા પર્વ-

તિથિએ। ન મળે તો ક્ષીણુતિથિયુક્ત પૂર્વની તિથિ ક્ષીણુ  
તિથિના નામવાળી પણ અને છે, કિન્તુ ક્ષીણુ-તિથિયુક્ત  
પૂર્વની તિથિ પૂર્વ તિથિના જ નામવાળી રહે એમ નહિ,  
પણ તે ક્ષીણુ તિથિની સંજાવાળી પણ અને છે. ’

[ ૬ ]

અર્થાત્ત્રાચીનાસ્તિથય : ક્ષીણતિથિસંશ્કિકા અપિ ભવેયુ. ।  
ન ‘પૂર્વ એવ’ = પૂર્વાતિથિનાસ્ત્ય એવ ભવેયુ: ‘કિન્તુ ઉત્તર  
સંશ્કિકા અપીતિ ભાવઃ ।’ (તત્ત્વતરંગિણી દીક્ઠા)

**ભાવાર્થ** :—પૂર્વની સાતમ વગેરે તિથિદિન પણીના  
ક્ષીણુ આડમ તિથિના નામવાળા પણ અને છે; અર્થાત તે  
દિવસ ભાત્ર પૂર્વના તિથિ નામવાળા જ થાય એમ નહિ કિંતુ  
ઉત્તર તિથિના નામવાળા પણ અને છે. ( અર્થાતુ એ  
તિથિ લેણી. )

[ ૧૦ ]

‘ન ચ પ્રાક ચતુર્દશ્યેવેત્યુક્તમ्, અત્ર તુ ‘अવરावी’  
સ્થનેન ‘અપિ’ શબ્દાદન્યસંજાપિ ગૃહ્ણાતે, તત્કથં ન વિરોધ  
ઇતિ વાચ્યં, પ્રાયશ્ચિત્તાદિવિધાવિત્યુક્તવાત् ।

( ત૦ ત૦ પૃ ૩ )

**ભાવાર્થ**—‘પહેલાં તો તમે ચૌદ્ધના ક્ષેત્ર તેરસને  
તેરસ કહેવાય જ નહિ, ચૌદ્ધશ જ કહેવાય’ એમ કહી  
ગયા; અને અહીં તો ‘બીજુ પણ’ એમાં પહેલા ‘પણ’  
શાખથી ચૌદ્ધશ પણ કહેવાય અને તેરસ પણ કહેવાય’  
એમ જણાયું, તો વિરોધ કેમ નહિ આવે? ’ એવી શંકા.

કરવી નહિ. કારણ કે 'તેરસ કહેવાય જ નહિ અને ચૌદ્ધશ  
જ કહેવાય' એવું જે કહું તે માત્ર પ્રાયશ્ક્રિતાદિ વિધિ  
અંગે જ કહું છે. ( અથોત् બીજ નિમિત્ત અંગે તેરશ પણ  
કહેવાય. )

[ ૧૧ ]

'ક્ષીણાષ્ટમીપૌષધસ્યાર્વહુપસપ્તમ્યાં ક્રિયમાણત્વેનાઙ્ગી-  
કારસ્યાપલપિતુમશક્તે : ॥ '

( ત. તરં૦ પૃ. ૨૮ )

'ક્ષાવાર્થ' 'ક્ષીણ આઠમનો પૌષધ અપર્વ રૂપ સાત-  
મભાં કરાતો હોવાના સ્વીકારનો અપત્તાપ થઈ શકશે નહિ. '

( અથોત્ સાતમને સાતમ પણ કહેવાતી અને પર્વના હિસાબે  
આઠમ પણ કહેવાતી, પરંતુ સાતમનો ક્ષય નહિ કરવાનો. )

[ ૧૨ ]

'ન હિ કનકરતનમયકુણડલે કનકરતન જ્ઞાન ભ્રાન્ત  
ભવિતુમર્હતિ ।'

'એવમેકસ્મન્નેવ રવ્યાદિવારલક્ષણે વાસરે દ્વયોરાપિ  
તિથ્યો : સમાપ્તત્વેન વિદ્યમાનત્વાત्' ( ત૦ તરં૦ પૃ. ૬ )

ખરેખર ! સોના અને રતનમય કુંડલમાં 'સોનું' અને રતન  
છે, એ જ્ઞાન ભ્રાન્તિવાળું હોઈ શકતું નથી. '

એ પ્રમાણે એક જ રવિવાર આદિ દિવસે તેરસ

ચૌદ્ધશ અન્ને તિથિએં સમાપ્ત થયેલી હોવાથી તેરસેથ છે. અને ચૌદ્ધશેય છે.

## [ ૧૩ ]

એવં કુટિતતિથિસંયુક્તા તિથિ : કારણવિશેષે શ્યુપ-  
યોગિની ભવન્ન્યપિ ન પુનર્બલઘતકાર્યં વિહાય સ્વકાર્યસ્થૈવો-  
પયોગિની ।'

એવી જ રીતે ક્ષીણુ તિથિચુક્તત તિથિ કારણુ વિશેષે  
ઉપયોગી અનવા છતાં અલવાન કાર્યને છોડી પોતાનાં જ  
કાર્ય માટે તે ઉપયોગી અની શકે છે એવું નથી.

( અથોત કારણુ વિશેષે પર્વતિથિનો વ્યપદ્દેશેય કરાય છે અને  
અલવાન ફાર્માં તેનોય સ્વીકાર કરાય છે. )

## [ ૧૪ ]

શ્રીસાગરજી મહારાજના શુરુજ શ્રીઅવેરસાગરજી-  
એ પણ ‘એકમ દુજ મેળિ કરણી’ એમ કહ્યું છે. ( નહિ.  
કે એકમનો કથ્ય. )

## [ ૧૫ ]

‘નન્વેવં પૌર્ણમાસીક્ષયે ભવતામપિ કા ગતિરિતિ ચેતુ,  
અહો વિચારચાતુરી, યત સ્તત્ર ચતુર્દશ્યાં દ્વયોરપિ વિદ્યમાન-  
ત્વેન તસ્યા અવ્યારાધનં જાતમેવેતિ ।’ ( ત૦ તર્ણિગણી )

ખરતર તપાને પૂછે છે, “ પુનમના ક્ષયે તમે શું  
કરશો ? ” તપાગચ્છીય કહે છે, “ એમ જે તમે પૂછતા-  
હો તો, વાહ ! તમારી વિચારચાતુરાઈ ! કારણુ કે ચૌદ્ધશના.

‘હિવસે ચૌદ્ધા પુનમ અન્ને વિઘમાન હોવાથી અમારે દો પુનમની પણ આરાધના ચૌદ્ધા લેગી થઈ જ જાય છે. ’

( આ શાંકા સમાધાનમાં શાસ્ત્રકારે પુનમના કથે તેરસનેા કથ્ય કરવાનું કહ્યું નથી, કિન્તુ ચૈદશ પુનમની લેગી જ આરાધના બતાવી છે. )

[ ૧૬ ]

‘ય તિથિર્સ્મન્નેવાદિત્યાદિવારલક્ષણે દિને સમાપ્યતે ન્સ દિનસ્તત્ત્વિથિત્વેન સ્વીકાર્યઃ । ’

‘જે રવિવારાદિ હિવસે જે તિથિ સમાપુણી હોય તે હિવસ તે તિથિર્સે સ્વીકાર્યે જોઈએ. ’

(તત્ત્વતરં ૨૦)

[ ૧૭ ]

‘અથાનન્તર્ય સ્થિતાસુ દ્વિત્રાદિકલ્યાણકતિથિષુ કિમેવા-  
ઽક્ષીક્રિયતે ઇતિ ચેત. ... અસ્માકમ ગ્રતેનકલ્યાણકતિથિઃ-  
પાતે પ્રાવીનકલ્યાણકતિથૌ દ્વયોરપિ વિઘમાનત્વાદિષ્ટાપચ્ચ-  
તેવોસરમ् । ’

( તત્ત્વતરં ૨૦ )

નેડાનેડ આવેલી એ ત્રણુ કલ્યાણુક—તિથિએમાં  
કથ્ય હોય ત્યારે શું તમે એમ જ એક હિવસમાં એની

આરાધના માનો છે ? આ શંકાના ઉત્તરમાં, અમારે તો પછીની કલ્યાણકાળિથિ પડી હોય ત્યારે પૂર્વ કલ્યાણકાળિથિમાં તે અન્ને તિથિએ હોવાની ઈષ્ટાપત્તિ એ જ અમારો ઉત્તર છે. ’

[ ૧૮ ]

એવં ક્ષીણતિથાવપિ કાર્યદ્વયમદ્ય કૃતવાનહમિત્યાદ્યો  
દૃષ્ટાન્તા : સ્વયમ્ભૂહા :—

( તત્ત્વતરં ૦ )

‘ એ જ પ્રમાણે ક્ષીણતિથિ એટલે બેળી થતી એ  
પર્વતિથિના પ્રસંગે પણ ‘આજે મેં એ કાર્યો કર્યાં ’  
ઇત્યાદિ દૃષ્ટાન્તો તમારે સ્વયં વિચારી લેવાં.

શ્રી ધર્મસાગરજીનું આ લખાણું રૂપણ અતાવી આપે  
છે કે ‘આજે મેં એ કાર્યો કર્યાં ’ એ દૃષ્ટાન્તથી ક્ષય  
પ્રસંગે ચૌદ્દશ પૂનમ આદિ અન્ને પર્વતિથિએની એક જ  
હિવસે આરાધના કરી લેવાય છે, પણ તેરશનેા ક્ષય નથી  
કરાતો.

[ ૧૯ ]

તેરશ ચૌદ્દશ બેળાં કરાય તેા ચૌદ્દશનાં પચ્ચુખાણ.  
સુવારથી શી રીતે થશે ?

આતું સમાધાન શ્રી સિદ્ધચક વર્ષ ૪ અંક ૪. પૃ.  
૮૫માં પૂ. શ્રી સાગરજી મહારાજે નીચે પ્રમાણે લખ્યું છે—

‘ક્ષયને સ્થાને સૂર્યોદયવાળી તિથિ દેવી, એમ  
કોઈ પણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના ક્ષય વખતે  
તો ભાત્ર તે પર્વતિથિને લોગવટો જ લેવાય ને  
તેથી ક્ષયે પૂર્વા તિથિ : કાર્યા એમ કહેવાય છે.’

(આ લખાણ સૂચવે છે કે એ પૂનમ વખતે પહેલી  
પૂનમમાં ચૈદશને લોગવટો જ નથી, તેથી ત્યાં ચૈદશ  
કરી શકાય જ નહિ.)

[ ૨૦ ]

(શ્રી પ્રવચન પરીક્ષા પૃ, ૪૧૨ )

બ્રયોગદશ્યાં દ્વયોરાયિ તિથ્યોઃ સમાપ્તત્વેન ચતુર્દિશયા  
અયિ સમાપ્તિસૂચકઃ સ સૂર્યોદયઃ સંપન્ન એવ । —

તેરસે ખંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી  
તેરસને સૂર્યોદય ચૈદશની પણ સમાપ્તિને સૂચવનારે  
થયો જ છે. (અર્થાત્ તેરશ-ચૈદશ લેગાં રહે છે.)

[ ૨૧ ]

૬. શ્રી ધર્મસાગરજી તત્ત્વતરંગિણી પૃ. ૬ માં—  
નનુ કથં તર્હાનન્તરદિને ભવિષ્યદ્વારં કલ્યાણકતિથિદિને

च पृथक् तपः समाचर्यते इति चेत्, उच्यते, कल्याण-  
काराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति । स च  
द्विधा-निरंतर तपश्चिकीर्षुः सान्तरतपश्चिकीर्षुश्च, तत्राद्य  
एकस्मिन्दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदा-  
राधकोऽपि सन्ननन्तरोत्तरदिनमादायैव तपःपूरको  
भवति, नान्यथा, यथा पूर्णिमापाते (पाक्षिक) चातुर्मा-  
सिक षष्ठतपोऽभिग्रही (अपरदिनमादायैव तपःपूरकः)  
द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति ।

प्र०—‘ तो । पछी थीजे हिवसे के आगामी वर्षमां  
कल्याणुक तिथि हिवसे तप जुहो डेम उरी अपाय छे ?’  
उत्तर—कल्याणुक तिथिनो आराधक प्रायः तपविशेष करवाना  
अलिङ्गहवालो। होय छे, ते ऐ प्रकारनो छे। एक निरंतर  
करवानी इच्छावालो। अने थीजे आंतरे करवानी इच्छावालो।  
तेमां निरंतरनी इच्छावालो। एक हिवस अने कल्याणुक  
तिथिओनी विघमानता होवाथी ते अनेनो आराधक थवा  
छतां साथेनो। हिवस अहुषु करीने ज तपने पूर्णु करवावालो।  
थैश्य शकै छे, थील रीते नहि। डेम पुनभनो। क्षय होय  
त्यारे चामासी छठनो। अलिङ्गही थीजे हिवस अहुषु करीने  
ज तपने पूर्णु करवावालो। थाय छे, तेम के आन्तरे तप  
करवाना अलिङ्गहवालो। होय ते थीजे वर्षे कल्याणुक  
तिथियुक्ता हिवस अहुषु करीने तपपूरक थाय छे।

[ ૨૨ ]

શ્રી સેનપત્રા પૃઠો ૮૭-૧માં લખ્યું છે કે —

“ એકાદશીવૃદ્ધૌ શ્રી હીરવિજયસૂરીણાં નિર્વાણમહિમપો-  
ચબોપવાસાદિકૃત્યં પૂર્વેસ્યામપરસ્યાં વા, કિ વિદેયમ् ? ”

અગીયારસની વૃધ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિના  
સ્વર્ગિયમન મહિમાનો પૌષ્ઠ-ઉપવાસ-આદિ કૃત્ય પહેલી  
અગીયારસે કરવું કે બીજુ અગીયારસે કરવું ? ’

( આ પ્રશ્નવાક્યમાં તિથિની વૃધ્ધિ હોય ત્યારે પહેલી  
બીજુનો વ્યપહેશ માન્ય કર્યો છે; તેથી પણ એ અગીયારસની  
એ દરશક કરવાનું પગલું પાછળથી નીકળેલું અને અશાસીય  
સિદ્ધ થાય છે. )

[ ૨૩ ]

“ શ્રી પ્રવચન પરીક્ષા ” પૃ. ૪૦૮માં શ્રી ધર્મસાગરજીએ  
લખ્યું છે કે—સૂર્યોદયદ્વયસ્પર્શિની તિથિવૃદ્ધેત્યુચ્યતે, તત્ત્વાદ-  
સૂર્યોદયાવચ્છિન્ના તિથિ : પ્રથમોઽવયવો, દ્વિતીયોદ્વયાવ-  
ચ્છિન્ના ચ દ્વિતીયોઽવયવો ભાણ્યતે । ”

એ સૂર્યોદયને સ્પર્શનારી તિથિ વૃદ્ધતિથિ કહેવાય છે.  
તેમાં પહેલા સૂર્યોદયવાળી તિથિ પહેલી અને બીજા  
સૂર્યોદયવાળી તિથિ બીજુ કહેવાય છે. ( આમાં એ સૂર્ય-

‘યું છે કે એ પૂનમ વખતે પહેલી પૂનમને પહેલી પૂનમ જ કહેવાય, ચૌદ્ધશ નહિ.

[ ૨૪ ]

એવં ચ સતિ તિથિમાસયોરાદ્યયોરંશયો, પ્રથમ તિથ્યા-  
દિસંજા સ્યાત्— ”

‘આ પ્રમાણે હોવાથી વૃદ્ધ તિથિ-માસના પહેલા અંશની પહેલી તિથિ આદિ સંજા થાય છે.’ (જેમ એ ભાડરવામાં પહેલા ભાડરવાને શ્રાવણ નથી કહેવાતો, તેમ એ પૂનમમાં પહેલી પૂનમને ચૌદ્ધશ ન કહેવાય.)

[ ૨૫ ]

સિદ્ધયક્ત વર્ષ ૪, અંક ૪, ટાઇટિલ પૃ. ઉમાં જણ્ણાયું  
છે કે—“ધ્યાન રાખવું કે પણ્ણીમાં એકમ વિગેરે તિથિએ  
વધી અગર ધર્મી હોય એટલે તૂંકી અગર એવડી થઈ, પણ  
તે તમામ તિથિએ પંદરને અંગે જ છે.’ ( અર્થાતું પૂન-  
મક્ષયે એક જ દિવસે ચૌદ્ધશ-પૂનમ હોવા છતાં પર્વતિથિ  
એક નહિ, પણ એ ગણ્ણાય.)

[ ૨૬ ]

શ્રી પ્રવચનપરીક્ષા પૃષ્ઠ ૪૦૮ માં લખ્યું છે કે—

પ્રથમા તિથિમાસો વા ‘નિજકુતામકાર્યેષુ’-અંશાઢાદિ)

३४

मासेषु प्रतिपदादितिथिनु चेदं कर्तव्यादिरूपेण स्वस्वनामा-  
क्षितकृत्येषु नपुंसक इव नपुंसको बोध्यः ॥ १

अलिवधिंत तिथिभास, पोतानुं नाम कायम छतां  
पोताना नामथी सूचित कार्य संबंधमां नपुंसक जेवा छे.

[ २७ ]

‘हिनशुद्धिपिका’ मां भुनिश्री दर्शनविजयलाले  
पछु पू. पपमां लभ्युं छे के-तिथि ऐ सूर्योदयने जुवेतो  
वृाध्यतिथि कडेवाय छे. तेमां पहेली वृाध्यतिथि अने  
भील अकृति तिथि छे. (आमां पछु पहेली तिथिने पूर्वनी  
तिथिनुं नाम नथी आच्युं.)

[ २८ ]

श्री कृपसूत्र सुषेाधकामां ६. श्री विनयविजयल-  
महाराजा झरभावे छे के—

‘भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव यथा  
चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगणन्य द्वितीयायां चतुर्दश्यां  
पाक्षिककृत्यं क्रियते ।’

‘जेम चौदशनी वृद्धिमां पहेली चौदश छाडीने भील

ચૌદ્ધો પખખી કૃત્ય કરાય છે, તેમ ભાડશવાની વૃદ્ધિમાં પહેલો ભાડરવો અપ્રમાણુ જ છે. ' (આમાં એ ચૌદ્ધોને અદ્ધે એ તેરસો કરવાનું કહેતા જ નથી. )

[ ૨૬ ]

શ્રી કદમ્પસ્કુત્રહીપિકા વ્યાખ્યાન દમાં લખ્યું છે—

વિવક્ષિતં પાદ્ધિકપ્રતિક્રમણं ચતુર્દશ્યાં નિયતં સા ચ  
યદિ વર્દ્ધિતા તદા પ્રથમાં પરિત્યજ્ય દ્વિતીયાક્રીકાર્યા—

વિવક્ષિત પાદ્ધિક પ્રતિક્રમણ ચૌદ્ધો નિયત છે, તે ચૌદ્ધો જો વધી હોય તો પહેલી છોડીને બીજી અંગીકાર કરવી.  
(આમાં પણ પહેલી ચૌદ્ધોને તેરસ કરવાનું નથી કહ્યું. )

[ ૩૦ ]

પ્રવચનપરીક્ષા પૃ. ૪૧૨ માં લખ્યું છે કે—વિચિ

પ્રપાયામયિ 'જયા પક્ષિન્દ્રાપ પબ્વતિહી પડ્દ તથા પુબ્વતિહી  
ચેવ ધેત્તબ્ધા, ન ઉજ્જરા તબ્દોગગન્ધસ્સવિ અભાવાઽ' ત્તી,  
પતચચ દુણાક્ષરન્યાયેન સમ્યક પતિતમ ! "

' પખખીને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ અહણુ  
કરવી, 'પછીની તિથિ નહિ લેવી, કેમકે ત્યાં તેના લોગની  
ગંધ સરળી નથી.' આ વચન એ અન્થમાં ધુષ્પાક્ષર  
ન્યાયથી સાચું પડી ગયું છે. ( એ જ ન્યાયે એ પૂનમ વખતે

३६

પહેલી પૂનમાં ચૌદ્ધશાના લોગની ગંધ સરખી નથી, તેણું ચૌદ્ધશ કેમ થાય? )

[ ३१ ]

શાસ્કિય પૂરાવાની નં. ૧-પૃ. ૨, નં. ૩-પૃ.-૬ ને  
તિથિ-હાનિ. વૃદ્ધિ-વિચારમાં લખ્યું છે કે—“પ્રથમાં  
ચૂર્ણિમાં પરિત્યજ્ય દ્વિતીયાં પૂર્ણિમાં ભજ :।” લાવાર્થ:—  
પહેલી પૂનમ છોડીને ખોળ પૂનમે પૂનમતું કાર્ય કરે.

[ ३२ ]

સં. ૧૫૮૮ પૂ. આ. શ્રી આનન્દવિમલસૂરિ મહા-  
રાજે કુરમાવેલા સાધુમચ્યોદાપદ્ધકમાં પણું લખ્યું છે: ‘તિથિ  
વાધ્યાં તિહાં એગ દિન વિગાર્થ ન વહિરવી’ ( આમાં  
પણ એ આઠમ વર્ગે મંજૂર રાખીને એક આઠમે વિગય  
ન વહેરવાનું કુરમાયું છે.)

[ ३३ ]

વિ. સં. ૧૬૨૮માં શ્રી શાન્તિસાગરલુના હેન્દખીલમાં  
લખ્યું છે કે.....‘આવળ વદ ૧૩ બે સુકરર કરી; એ વાત  
ઘણા લોકોના સાંભળવામાં આવી, તેથી વિસમય પામ્યા કે

आ अज्ञकतुं न करवानुं काम शुं कर्युं के उदीयात चउ-  
दश लेपी...’ आ सालमा भाद्रवा सुहि १ नी वृद्धि हती. अने  
उद्य योद्धा न ज्ञ ईरवाय, ए सूचन्युं.

[ ३४ ]

श्री हीरप्रश्न पृ. ७८-७९माँ

प्रश्नः— पञ्चमीतिथित्रुटिता भवति तदा तत्पः  
कस्यांतिथौ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥ ५ ॥ उत्तरम्—  
अत्र पञ्चमीतिथित्रुटिता भवति तदा तत्पः पूर्वस्यां तिथौ  
क्रियते। पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी-चतुर्दशीः क्रियते;  
त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ॥ ५ ॥

पञ्चमी तिथि त्रुटेली होय त्यारे ते तिथि संबंधी  
तप उर्ध्व तिथिमां कराय छे ? अने पूर्णिमा त्रुटेली होय  
तो। उर्ध्व तिथिमां कराय छे ? ए प्रश्नना समाधानमां जछावे  
छे के—पञ्चमी तिथि त्रुटेली होय त्यारे तेनो। तप पूर्व-  
तिथिमां कराय छे। पूर्णिमा तूटी होय तो। तेनो। तप तेरस-  
चौदशमां कराय छे। तेरसे विस्मरण थये छते तो। पडवाने  
द्विवसे पछु पूर्णिमानो। तप करी शकाय। ”

( उपर्युक्त अर्थमां क्षय ने अदले क्षय करवानी गंध  
सरभीये नथी। पञ्चमीना क्षये पञ्चमीने पूर्वनी आथमां  
चोगीज भानी छे.)

[ ३५ ]

श्री हीरप्रक्ष पृ. ४५ मां

प्रश्न :— ‘यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अभावास्या-  
दिवृद्धौ वा अभावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदर्थं  
षष्ठतपः क्व विधेयम् ? उत्तरम् - यदा चतुर्दश्यां कल्पो  
वाच्यते...’ इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति  
यथारुचि तद्विधीयतामिति कोऽन्नाग्रह ? ’।

प्रश्न : ज्यारे चौदशे कल्प वंचाय अथवा अभा-  
वास्याहि तिथिनी वृद्धिमां अभावास्याए छिंवा पडवे कल्प  
वंचाय त्यारे छकुनो तपु क्ये दिवसे करवे ?

उत्तर : ज्यारे चौदशे “के अभावास्याहिए कल्प  
वंचाय त्यारे छकु तपु करवामां दिवसनु नियतपणुं नथी-  
ठीक लागे तेम करो. एमां आअह शो ? ”

आनी भतलभ ए से छे के पर्युषणु अकुर्धि जे अगि-  
यारसथी ऐसे तो तेरस-चौदशे छकु करवे. जे भारसथी  
ऐसे तो चौदश-अभासे करवे. अने अभावास्याहि तिथि-  
वृद्धिमां जे तेरसथी ऐसे तो तेरस-चौदशे करवे.

પહેલી અમાસ ખાધ્યાવાર ગણ્ણી, બીજી અમાસે કદ્વાધરનો  
ઉપવાસ કરવો. આથડ રાખવાનું કાઈ કારણ નથી.

[ ૩૬ ]

શ્રી સાગરાનન્દસ્વરિલુએ પણું આવાત કખૂલ રાખી છે.  
અને શ્રી સિદ્ધયાક વર્ષ ૧, અંક ૨૧, પૃ. ૫૦૭ માં નીચે  
પ્રમાણે ઉતારી છે—“ પચ્ચુખણુંના કદ્વા સંબંધી છુટુ કરવામાં  
કોઈ પણ તિથિયોના નિયમને માટે આથડ કરવો નહિ.  
અર્થાત् એ ચૌદશો હોય તો પહેલી બીજી ચૌદશનો પણ  
છુટુ થાય, એ અમાવાસ્યા હોય તો તેરશ ચૈદશનો છુટુ  
થઈ, (પહેલી અમવાસ્યાએ પારણું કરી) બીજી અમા-  
વાસ્યાએ એકદો ઉપવાસ થાય, અને એ પડવા હોય તો  
પણ તેરસ-ચૌદશનો છુટુ થઈ અમવાસ્યાએ પારણું આવી  
પહેલે પડવે એકદો ઉપવાસ થાય.”

આ અધા પ્રમાણો નજર સંમુખ રાખવાથી એ નિઃસં-  
હેઠ સિદ્ધ થઈ જય છે કે ગમે તે પર્વતિથિની ક્ષય-  
વૃદ્ધિ ટીપણુંમાં આવી હોય, તે તેમની તેમ જ રાણીને  
આરાધનાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. એને અદ્વાત  
બીજી તિથિએની ક્ષયવૃદ્ધિ કરો તો (૧) મૃષાભાષણ

થાય છે, (૨) ઉદ્યતિથિ વિરાધાય છે. (૩)  
તથા અપવે એવાં થાય છે. (૪) આજાલ  
મિથ્યાત્મ, અને વિરાધનાના હોષે લાગે છે

### જૈન જયતિ શાસનમ् ॥

જૈન જગૃતિ લેખમાળામાં પ્રગટ થયેલાં પુર

- (૧) જાગ રે જૈન સમાજ !
- (૨) આપણી દુર્દશા॥.
- (૩) તિથિ સંબંધી જાણવા જેવું.
- (૪) તિથિ અગે તરખાટ કેમ થયો ?
- (૫) હવે કરવું શું ?

પૂરો સેટ મેળવવા ચાંર આનાના પોં  
સ્ટેમ્પ બીડા.

: પ્રામિસ્થાન :

કાંતિલાલ માણેકલાલ શાહ  
પાડાપોણ, અમદાવાદ.